

New syllabus (1879)

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
(W.e.f.-તુલ-૨૦૧૮-૧૯)
આચાર્ય-૧ યોગ

ક્રમ	પેપર	વિષય	માર્કસ
૧	૧	યોગ વિજ્ઞાન	૧૦૦
૨	૨	માનવ શરીર રચના અને કિયા વિજ્ઞાન	૧૦૦
૩	૩	ઘેરંડ સંહિતા	૧૦૦
૪	૪	પાતંજલયોગદર્શન પાદ ૧-૨	૧૦૦
૫	૫	પ્રાયોગિક	૧૦૦

આચાર્ય-ર યોગ

ક્રમ	પેપર	વિષય	માર્ક્સ
૧	૬	યૌગિક ચિકિત્સા અને માનસિક સ્વાસ્થ્ય	૧૦૦
૨	૭	હઠયોગ પ્રદિપીકા	૧૦૦
૩	૮	પાતંજલયોગ દર્શન (પાદ ૩-૪)	૧૦૦
૪	૯	રીસર્ચ મેથ્ડ્ડ :- (૧) પ્રોજેક્ટ (૨) સંસ્કૃત સંભાષણ (૩) ટીચીંગ મેથ્ડ્ડ	૧૦૦
૫	૧૦	પાયોગિક	૧૦૦

પેપર-૧ યોગાયુક્તિ

(૧) પ્રાર્થના :-

- પ્રાર્થનાની વ્યાખ્યા
- પ્રાર્થનાની ઉત્પત્તિ
- પ્રાર્થનાના પ્રકારો
- પ્રાર્થનાનું મહત્વ અને ઉપયોગિતા

(૨) યોગવિદ્યાનો પરિચય :-

- યોગનો પરિચય
- યોગ શબ્દની ઉત્પત્તિ
- યોગનો ઈતિહાસ
- યોગની વિભિન્ન વ્યાખ્યાઓ
- યોગનો ભાષાકીય અર્થ
- યોગનો ઉપયોગ/મહત્વ
- યોગના ભામક જ્યાલો
- યોગના પ્રકારો
-

(૩) પતંજલિ નિર્દ્દિશિત અષ્ટાંગ યોગ

- અષ્ટાંગ યોગનો પરિચય
- યમનો પરિચય
- નિયમનો પરિચય
- આસનનો પરિચય
- પ્રાણાયમનો પરિચય
- પ્રત્યાહારનો પરિચય
- ધારણાનો પરિચય
- ધ્યાનનો પરિચય
- સમાધિનો પરિચય
- અષ્ટાંગયોગના અભ્યાસથી થતા લાભ
-

(૪) યમનો પરિચય :-

- યમનું મહત્વ / લાભ
- યમ

	મુખ્ય યમ	ગૌણ્યમ
(૧)	સત્ય	(૧) ક્ષમા
(૨)	અહિંસા	(૨) ધૃતિ
(૩)	અસ્તેય	(૩) દયા
(૪)	અપરિગ્રહ	(૪) આર્જવ
(૫)	બ્રહ્મચર્ય	(૫) મિતાહાર

(૫) નિયમોનો પરીચય :—

➤ નિયમના મહત્વ / લાભ

	<u>મુખ્યનિયમ</u>	<u>ગૌણનિયમ</u>
(૧)	શૈચ	(૧) આસ્તિકય
(૨)	સંતોષ	(૨) દાન
(૩)	તપ	(૩) સિદ્ધાંતશ્રવણ
(૪)	સ્વાધ્યાય	(૪) છિ
(૫)	ઈશ્વરપ્રાણિધાન	(૫) મતિ (૬) જ્ય

(૬) આસન પરીચય :—

- આસનની વ્યાખ્યા
- આસનનો મહત્વ
- આસનના પ્રકારો
- આધુનિક યુગમાં આસનની ઉપયોગિતા
- આસનમાં ધૈર્ય અને લાભ
- આસન કસરત વચ્ચેનો તફાવત
- આસન જીમાસ્ટિક વચ્ચેનો તફાવત
- આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો (સૂચનો)

(૭) પ્રાણાયામનો પરિચય :—

- પ્રાણાયામનો અર્થ
- પ્રાણાયામની વિભિન્ન વ્યાખ્યાઓ
- પ્રાણાયામના પ્રકારો
- પ્રાણાયામના પ્રકારો (૧) મુખ્ય અને (૨) ગૌણ
- શ્વાસપ્રશ્વાસની પદ્ધતિઓ
- અષ્ટકુંભકો

(૮) પ્રત્યાહારનો પરિચય :—

- પ્રત્યાહારની પરિભાષા
- પ્રત્યાહારનું પ્રયોજન
- પ્રત્યાહારનું સ્વરૂપ અને મહત્વ
- પ્રત્યાહારથી થતી લાભ
- જાનેન્દ્રિયો, કર્મન્દ્રિયો

(૯) ધારણાનો પરિચય :—

- ધારણાની પરિભાષા
- ધારણાનું પ્રયોજન
- અઢાર મર્મસ્થા પર ધારણા
- ચકોમા ધારણા



- ધારણાની અંતરાયો
- ધારણાથી પ્રાપ્તિ થતી સિદ્ધીઓ

(૧૦) ધ્યાનનો પરિચય :—

- ધ્યાનની પરિભાષા/વ્યાખ્યાઓ
 - ધ્યાનનું પ્રયોજન/હેતુ
 - ધ્યાન કરતી વખતે ધ્યાનમાં રાજ્યવાની બાબતો
 - ધ્યાનનું મહત્વ / લાભ
 - ધ્યાન કરવાના અવયવો / આંતરીક અને બાહ્ય
 - ધ્યાનના પ્રકારો
 - ધ્યાનની જુદી-જુદી પદ્ધતિઓ
- | | | |
|--------------|-------------|-----------------|
| (૧) વિપ્લયના | (૨) ભાવાતિત | (૩) પેક્શાધ્યાન |
|--------------|-------------|-----------------|

(૧૧) સમાધિ પરિચય :—

- સમાધિની પરિભાષા/ વ્યાખ્યાઓ
- સમાધિની અવસ્થાઓ
- સમાધિના પ્રકારો
- સમાધિનું મહત્વ / ઉપયોગિતા

(૧૨) ચક્રોનો પરિચય :—

- | | | |
|---------------|-------------------|---------------|
| (૧) સહસ્રારચક | (૨) આશાચક | (૩) વિશુદ્ધચક |
| (૫) માણિપૂરચક | (૬) સ્વાધિષ્ઠાનચક | (૭) મૂલધારચક |

(૧૩) અષ્ટસિદ્ધિઓ :—

(૧૪) સૂર્યનમસ્કારનો પરિચય :—

- સૂર્યનમસ્કારનું પૌરાણિક મહત્વ
- સૂર્યનમસ્કાર મંત્રો સાથે
- સૂર્યનમસ્કાર શ્વાસ પ્રશ્વાસ સાથે
- સૂર્યનમસ્કારના લાભ

(૧૫) નાદિઓનો પરિચય :—

- (૧) ઈડા
- (૨) પિંગલા
- (૩) સુષુપ્તા
- નાદિઓના નામ, સ્થાન અને કાર્યો

(૧૬) વૈદિક અને આધુનિક પરંપરામાં યોગ :—

પેપર-૨ માનવશરીર રચના અને કિયાવિજ્ઞાન

(૧) શરીર રચના :—

- શરીર રચનાની વ્યાખ્યા
- શરીર રચનાનો પરિચય
- શરીર રચનાના જ્ઞાનની આવશ્યકતા / જરૂરીયાત
- શરીર કિયાવિજ્ઞાનની વ્યાખ્યા

(૨) શરીરના આવેલ તંત્રો :—

- શરીરમાં આવેલ તંત્રોના નામ
- શરીરમાં આવેલ તંત્રોના કાર્યો

(૩) અંતસ્ત્રાવિગંથીઓ :—

- અંતસ્ત્રાવિ ગંથીઓના નામ, સ્થાન અને કાર્યો
- અંતસ્ત્રાવિ ગંથીના જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૪) શ્વસનતંત્ર :—

- શ્વસનતંત્રનો પરિચય / રચના
- શ્વસનતંત્રના મુખ્યઅવયવો અને કાર્યો
- શ્વસનતંત્રના જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૫) ઝુદ્ધિરાભિસરણતંત્ર :—

- ઝુદ્ધિરાભિસરણતંત્રનો પરિચય અને રચના
- ઝુદ્ધિરાભિસરણતંત્રના મુખ્યઅવયવો અને તેના કાર્યો
- ઝુદ્ધિરાભિસરણતંત્રના જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૬) અસ્થિતંત્ર :—

- અસ્થિતંત્રનો પરિચય અને રચના
- અસ્થિતંત્રના અવયવો અને તેના કાર્યો
- અસ્થિતંત્રના જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૭) ઉત્સર્જનતંત્ર :—

- ઉત્સર્જનતંત્રનો પરિચય અને રચના
- ઉત્સર્જનતંત્રના અવયવો અને તેના કાર્યો
- ઉત્સર્જનતંત્રની જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૮) પાચનતંત્ર :—

- પાચનતંત્રનો પરિચય અને રચના
- પાચનતંત્રના મુખ્ય અવયવો અને કાર્યો
- પાચનતંત્રની જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૯) સ્નાયુતંત્ર :-

- સ્નાયુતંત્રનો પરિચય અને રચના
- સ્નાયુતંત્રના મુખ્ય અવયવો અને કાર્યો
- સ્નાયુતંત્રની જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૧૦) નાઉિતંત્ર / ચેતાતંત્ર :-

- નાઉિતંત્રનો પરિચય અને રચના
- નાઉિતંત્રના મુખ્ય અવયવો અને કાર્યો
- નાઉિતંત્રની જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૧૧) પ્રજનનતંત્ર :-

- પ્રજનનતંત્રનો પરિચય અને રચના
- પ્રજનનતંત્ર સત્ત્વી અને પુરુષનું અલગ અલગ
- પ્રજનનતંત્રના અવયવો
- પ્રજનનતંત્રની જ્ઞાનની યોગમાં ઉપયોગિતા

(૧૨) આહારની વ્યાખ્યા :-

- આહારનું મહત્વ
- આહારના ઉદ્દેશ્યો , આહારના ઘટકો
- આહારના કાર્યો , સમતોલ આહાર
- સ્વાસ્થ્ય પર આહારનો પ્રભાવ
- કુપોષણથી થતા રોગ અને તેના ઉપયાર

પેપર-૩ ઘેરડ સંહિતા

(૧) અધ્યાય-૧

- ષટ્કર્મ
 - (૧) ધોતિ
 - (૨) બસ્તિ
 - (૩) નેતિ
- (૪) ગ્રાટક
 - (૫) કપાલભાતિ
 - (૬) નૌલિ

(૨) અધ્યાય-૨

- આસનો
- (૧) બેઠા—બેઠાના આસનો
- (૨) ઉભા—ઉભાના આસનો
- (૩) સૂતા—સૂતાના આસનો
- તર આસનો

(૩) અધ્યાય-૩

➤ બંધ / મુદ્રાઓ / ધારણા :-

- (૧) મૂલબંધ
- (૨) જાલંધરબંધ
- (૩) ઉદ્ધિયાનબંધ
- (૪) મહાબંધ

➤ ધારણાનો પરિચય :-

- (૧) પાથવી ધારણા
- (૨) આકાશી ધારણા
- (૩) જળ ધારણા(આંભશી)
- (૪) તેજધારણા(આંનેય)
- (૫) વાયુ ધારણા(વાયવ્ય)

➤ મુદ્રાઓ :-

- | | | |
|----------------------|----------------------|--------------------|
| (૧) મહામુદ્રા | (૨) નભોમુદ્રા | (૩) ખેચરી મુદ્રા |
| (૪) મહાવેદમુદ્રા | (૫) વિપરીતકરણીમુદ્રા | (૬) યોનિમુદ્રા |
| (૭) શક્તિચાલનમુદ્રા | (૮) નગાડીમુદ્રા | (૯) માન્યુકીમુદ્રા |
| (૧૦) શાંભવીમુદ્રા | (૧૧) અશ્વનીમુદ્રા | (૧૨) પાશિનીમુદ્રા |
| (૧૩) કાકીમુદ્રા | (૧૪) વજોષીસ મુદ્રા | (૧૫) માંતરી મુદ્રા |
| (૧૬) બુંજગીની મુદ્રા | | |

(૪) અધ્યાય -૪

➤ પ્રત્યાહાર

➤ છશ્નુઓ

(૫) અધ્યાય-૫

➤ પ્રાણાયમ :-

- | | | |
|----------------------|---------------------|------------------|
| (૧) નાદિશુદ્ધી | (૨) સહિત પ્રાણાયમ | (૩) સૂર્યનેદન |
| (૪) ચંદ્રનેદન | (૫) ઉજ્જ્વીપ્રાણાયમ | (૬) શિતલી |
| (૭) શિતકારી | (૮) બામરી | (૯) ભસ્ત્રકા |
| (૧૦) મૂર્છા | (૧૧) પ્લાવિની | (૧૨) અનુલોમવિલોમ |
| (૧૩) કેવલ્ય પ્રાણાયમ | | |

Date: 2023-09-18
Page No.: 7
Page No.: 7
Page No.: 7

(૬) અધ્યાય -૬

➤ ધ્યાન :-

(૧) સ્થુળ

(૨) સુક્ષમ

(૩) જ્યોતિ ધ્યાન

(૭) અધ્યાય -૭

➤ સમાધિ :-

(૧) ધ્યાનયોગ સમાધિ

(૨) નાદયોગ સમાધિ

(૩) રસાનંદ સમાધિ

(૪) લયસિદ્ધિ સમાધિ

(૫) ભક્તિ યોગ સમાધિ

(૬) રાજયોગ સમાધિ

પેપર-૪ પાતંજલયોગ દર્શન (પાદ ૧ અને ૨)

➤ પાતંજલયોગ દર્શન પાદ-૧ અને ૨

પાદ-૧ સમાધિ પાદ-૫૧ સૂત્રો

પાદ-૨ સાધન પાદ-૫૫ સૂત્રો

➤ સૂત્રો સાથે પાતંજલ યોગ દર્શનનો પરિચય

પેપર-૫ પ્રાચોરિક

(૧) પ્રાર્થના અને મંત્રોનું ગાન

➤ ગુજરાતી અને સંસ્કૃતમાં

(૨) યૌંગિક કિયાઓ

➤ શ્વાસ અને પ્રશ્વાસના કમ સાથે
 (૧) મહિની કિયા
 (૪) મુખ અને સ્વરનીકિયા
 (૭) હાથની કિયા
 (૧૦) કમરની કિયા
 (૧૩) કાયોત્સર્ગ

(૨) આંખની કિયા

(૫) ગઈનની કિયા
 (૮) છાતી અને ફેફસાની કિયા
 (૧૧) પગની કિયા

(૩) કાનની કિયા

(૬) ખભાની કિયા
 (૮) પેટની કિયા
 (૧૨) ગોઠણ અને પંજાની કિયા

(૩) પ્રાણાયામ

(૧) ઓમકાર પ્રાણાયામ
 (૪) શિતલી
 (૭) ચંદ્ર ભેદન

(૨) ભામરી

(૫) શિતકારી
 (૮) અનુલોમ વિલોમ

(૩) ભર્સિતકા

(૬) સૂર્યભેદન

(૪) બંધના પ્રકાર:—

➤ ઉદ્ઘિયાન બંધ
 ➤ જાલંધર બંધ
 ➤ મુલ બંધ
 ➤ મહાબંધ

(૫) સૂર્યનમસ્કાર

➤ સૂર્યનમસ્કાર, શ્વાસપ્રશ્વાસ, કાઉન્ટ સાથે
 ➤ સૂર્યનમસ્કાર મંત્રો સાથે

(૬) ઘટકર્મ:—

(૧) નેતિ
 ➤ કેષેટરનેતિ, કુજર/ ગજકરણી
 (૨) ધૌતિ
 ➤ સ્ટમકટયુબ
 (૩) કપાલભાતિ
 (૪) ગ્રાટક
 ➤ આતરગ્રાટક અને બાબુ ગ્રાટક
 (૫) નૌલિ
 ➤ મધ્યનૌલિ
 (૬) શાથિલિકરણ વ્યાયામ
 ➤ બેઠા બેઠા
 ➤ સૂતા સૂતા
 ➤ ઉભા ઉભા

PM

(7) મુદ્રાઓનો પરિચય :—

- હસ્તમુદ્રા :—

- (૧) પ્રાણમુદ્રા (૨) અપાન મુદ્રા (૩) વ્યાન મુદ્રા (૪) ઉદાન મુદ્રા (૫) વરુણ મુદ્રા (૬) સમાન મુદ્રા
 (૭) ધ્યાનમુદ્રા (૮) પ્રાણમુદ્રા (૯) વ્યાનમુદ્રા (૧૦) ઉદાનમુદ્રા (૧૧) પृથ્વીમુદ્રા (૧૨) સૂર્યમુદ્રા

- ધેરંડ સંહિતા :—

- (૧) મહામુદ્રા (૨) મહાવેદ મુદ્રા (૩) તડગી મુદ્રા (૪) વિપરીત કરણી મુદ્રા (૫) નભોમુદ્રા
 (૬) સાંભવીમુદ્રા

(૮) આસન પરિચય :—

➤ આસનની પદ્ધતિ અને લાભ

- | | | | |
|---------------------|----------------|---------------------|-------------------|
| (૧) અર્ધકટી ચક્કાસન | (૨) પાદહસ્તાસન | (૩) વિમુખત્રિકોણાસન | (૪) તાડાસન |
| (૫) નટરાજાસન | (૬) વજ્જસન | (૭) ઉષ્ણાસન | (૮) પદમાસન |
| (૮) વક્કાસન | (૧૦) સિદ્ધાસન | (૧૧) સુખાસન | (૧૨) યોગમુદ્રાસન |
| (૧૩) ઉત્કટાસન | (૧૪) ગૌમુખાસન | (૧૫) જાનુશિરાસન | (૧૬) ધનુરાસન |
| (૧૭) કુકુકુટાસન | (૧૮) શીર્ષાસન | (૧૯) એકપાદશિરાસન | (૨૦) ભૂમાસન |
| (૨૧) શવાસન | (૨૨) ભુજંગાસન | (૨૩) હલાસન | (૨૪) ચકાસન |
| (૨૫) ભદ્રાસન | (૨૬) તિતિભાસન | (૨૭) લોલાસન | (૨૮) શશાકાસન |
| (૨૮) મંડુકાસન | (૩૦) શાહમૃગાસન | (૩૧) વક્ષપાદાસન | (૩૨) વિક્ષેપાદાસન |
| (૩૩) શલ્યકાસન | (૩૪) ચાતકાસન | (૩૫) ગર્ભાસન | (૩૬) જાનુકશાસન |
| (૩૭) કોમલાસન | (૩૮) સંયમાસન | (૩૮) પર્વતાસન | (૩૮) પાદગૃહાસન |
| (૪૦) ક્રિઝાસન | (૪૧) દેવદૂતાસન | (૪૨) પૂજકાસન | (૪૩) વિમાનાસન |
| (૪૪) પ્રાર્થનાસન | (૪૫) સંકેતાસન | (૪૬) ઉદરકુંચાસન | (૪૭) દંડાસન |
| (૪૮) કૃપોતાસન | (૪૮) સંકોચાસન | (૫૦) બાલકાસન | |

સાંભળ પ્રાણાસન
અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ
અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ

એમ.એ. પાર્ટ-૨

પેપર-૬ ચૌંબિક ચિકિત્સા અને માનસિક સ્વાસ્થ્ય

- (૧) યૌગિક ચિકિત્સાની વ્યાખ્યા :-
 - યૌગિક ચિકિત્સાના ઘટકો / અવયવો / અંગો
- (૨) આયુર્વેદ ચિકિત્સાની વ્યાખ્યા :-
 - આયુર્વેદ ચિકિત્સાના ઘટકો / અવયવો / અંગો
- (૩) નૈસર્જિક ચિકિત્સાની વ્યાખ્યા :-
 - નૈસર્જિક ચિકિત્સાના ઘટકો / અવયવો / અંગો
- (૪) ડાયાબિટીશના લક્ષણો :-
 - ડાયાબિટીશની યૌગિક, આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૫) મંદાળિન/અસીડીટીના કારણો લક્ષણો :-
 - મંદાળિનના યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૬) કબજીયાતના કારણો લક્ષણો :-
 - કબજીયાતની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૭) ગેસના કારણો લક્ષણો :-
 - ગેસના યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૮) ઉલ્ટીના કારણો લક્ષણો :-
 - ઉલ્ટી ઉત્પન્ન યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૯) શ્વાસ/દમ ઉત્પન્ન થવાના કારણો લક્ષણો :-
 - શ્વાસની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૦) ક્ષય/ટી.બી. ના કારણો લક્ષણો :-
 - ક્ષય / ટી.બી.ની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૧) રક્તચાપ (બી.પી.) ના કારણો લક્ષણો :-
 - રક્તચાપ (બી.પી.) યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૨) સંધિવાના કારણો અને લક્ષણો :-
 - સંધિવાના યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૩) માથાના દુખાવાના કારણો અને લક્ષણો :-
 - માથાનો દુખાવાના યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૪) ચામડીના રોગના કારણો અને લક્ષણો :-
 - ચામડીના રોગની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૫) ફદ્યરોગના લક્ષણો અને કારણો :-
 - ફદ્યરોગની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૬) કુમળાના લક્ષણો અને કારણો :-
 - કુમળાની યૌગિક આયુર્વેદિક અને કુદરતી સારવાર
- (૧૭) માનસિક સ્વાસ્થ્ય :-
 - માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા
 - માનસિક સ્વાસ્થ્યનો પરિચય
 - માનસિક રોગના ઉત્પન્ન થવાના કારણો, લક્ષણો અને ઉપચાર
 - માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનાર પરિબળ
 - યોગ દ્વારા માનસિક રોગની સારવાર

(૧૮) બુદ્ધિ પરિચય :-

- બુદ્ધિની પાચીન અને અવાચીન વ્યાખ્યાઓ
- બુદ્ધિના લક્ષણો અને પ્રકારો
- ધોગ દ્વારા બુદ્ધિનો વિકાસ

(૧૯) સ્મૃતિ અને વિસ્મૃતિ

- સ્મૃતિ અને વિસ્મૃતિના કારણો, લક્ષણો અને ઉપચાર
- ધોગ દ્વારા સ્મૃતિનો વિકાસ

(૨૦) નિંદ્રા :-

- નિંદ્રાનો પરિચય
- નિંદ્રાના પ્રકારો
- અનિંદ્રા અને અતિનિંદ્રાના કારણો, લક્ષણો
- અનિંદ્રા અને અતિનિંદ્રાની ઘૌંઠિક સારવાર

(૨૧) ભાવનાત્મક સ્વાસ્થ્ય :-

- ભાવનાત્મક સ્વાસ્થ્યનો પરિચય
- ભાવનાત્મક સ્વાસ્થ્યના પ્રકારો
- હક્કારાત્મકભાવના અને નહ્કારાત્મકભાવના

(૨૨) માનસોપચાર (સાયકોથેરાપી)

- માનસોપચારનું સ્વરૂપ, વ્યાખ્યા, ધ્યેય, ઉપચાર
- માનસોપચારની વિવિધ પદ્ધતિઓ
- માનસોપચારને અસર કરતા પરિબળો

પેપર-૭ હઠ્યોગપ્રદિપિકા અને ભગવત ગીતા

(૧) હઠ્યોગનો પરિચય :

- હઠ્યોગનો યોગ્ય ઉપદેશ
- યોગસ્કિદ્ધિનાં કર્તા
- થમ નિયમ

(૨) અધ્યાય -૧ આસન પ્રકરણ :-

(૧)	સ્વસ્તિકાસન	(૨)	ગૌમુખાસન	(૩)	વિરાસન	(૪)	કુર્માસન
(૫)	કુક્કાસન	(૬)	ઉતાનકુર્માસન	(૭)	ધનુરાસન	(૮)	મસ્ત્યેન્દ્રાસન
(૯)	પશ્વિમોત્તાસન	(૧૦)	મયુરાસન	(૧૧)	શવાસન	(૧૨)	સિહાસન
(૧૩)	પદમાસન	(૧૪)	ભદ્રાસન	(૧૫)	સિંહાસન		

(૩) અધ્યાય - ૨ પ્રાણાયમ પ્રકરણ :-

- પ્રાણાયમનું પ્રયોજન
- મલશુદ્ધિથી હઠ્યોગની સિદ્ધિ
- પ્રાણાયમની વિશેષતા તેનું અવાંતર કામ અને અવધિ
- ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ પ્રાણાયમ
- નાડી શુદ્ધિનું લક્ષણ
- ઘટ્ટકર્મા

(૧) ધોતી (૨) બસ્તિ (૩) નૈતિ (૪) ત્રાટક (૫) નૌલી (૬) કપાલભાતી

- પ્રાણાયમના અભ્યાસની આવશ્યકતા
- અષ્ટકુંભકો

(૧)	સૂર્યલેદન	(૨)	ઉજ્જાયી	(૩)	શિતલી	(૪)	સિતકારી
(૫)	ભસ્ત્રકા	(૬)	ભામરી	(૭)	મૂર્છા	(૮)	ખાવિની

(૪) અધ્યાય - તુ મુદ્રા અને બંધ :-

(૧)	મહામુદ્રા	(૨)	મહાબંધ	(૩)	મહાવેખ મુદ્રા	(૪)	ખેચરી મુદ્રા
(૫)	ઉદ્દિયાન બંધ	(૬)	મૂલબંધ	(૭)	જાલબંધ બંધ	(૮)	વિપરીતકરણી મુદ્રા
(૮)	વળોલી મુદ્રા	(૧૦)	શક્તિચાલન મુદ્રા				

(૫) અધ્યાય - ૪ નાદાનુસંધાન (સમાપ્તિ)

(૧) આરંભાવસ્થા (૨) ધટાવસ્થા (૩) પરિચય-અવસ્થા (૪) નિષ્યતિ અવસ્થા

(૬) ભગવતગીતા પ્રમાણે યોગની વિભાવના (બીજો અને છઠો અધ્યાય સંક્ષિપ્તસાર)

- ભગવત ગીતાનો સામાન્ય પરિચય
- અધ્યાય – ૨ સંક્ષિપ્ત સાર
- અધ્યાય – ૬ સંક્ષિપ્ત સાર

(૭) વિવિધ ધર્મોમાં યોગનું સ્વરૂપ

પેપર-૮ પાતંજલયોગ દર્શન (પાદ ૩ અને ૪)

- પાતંજલયોગ દર્શન પાદ-૩ અને ૪
પાદ-૩ કેવળપાદ ૫૫ સૂત્રો
પાદ-૪ વિભૂતિપાદ ૩૪ સૂત્રો
- સૂત્રો સાથે પાતંજલ યોગ દર્શનનો પરિચય

પેપર-૯ રીસર્ચ મેથડ

- (૧) પ્રોજેક્ટ - ૨૫ માર્ક્સ
- (૨) ટીચીંગ મેથડ - ૨૫ માર્ક્સ (પાઠ આધ્યાત્મિક - પાઠી)
- (૩) સંસ્કૃત સંભાષણ - ૫૦ માર્ક્સ

પ્રોજેક્ટના વિષયો :-

- | | | |
|---------------------------------|-------------------------------|------------------------------|
| (૧) યોગનો પરિચય | (૨) યોગના આઠ અંગો(અષ્ટાંગયોગ) | (૩) યોગ ગ્રંથોનો પરિચય |
| (૪) યોગ અને આરોગ્ય | (૫) યોગ અને આયુર્વેદ | (૫) યોગ અને નિસર્ગોપચાર |
| (૭) ધ્યાનકર્મ | (૮) આયુર્વેદના પંચકર્મ | (૮) યોગ અને માનસિક સ્વાસ્થ્ય |
| (૧૦) યોગ દ્વારા સર્વાર્ગી વિકાસ | (૧૧) બાળકો/મહિલાઓ માટે યોગ | (૧૨) યૌગિક ચિકિત્સા |
| (૧૩) પાચનતંત્ર અને યોગ | (૧૪) તૃદ્વિશામિસરણ અને યોગ | (૧૫) શ્વસનતંત્ર અને યોગ |
| (૧૬) અંતસ્ત્રાયિ ગ્રંથિઓ | (૧૭) યમ નિયમ | (૧૮) આસન પરિચય |
| (૧૮) પ્રાણાયામ પરિચય | (૨૦) ધ્યાન પરિચય | (૨૧) મુદ્રાઓ-ધૈરંડ સંહિતા |
| (૨૨) નાડીઓ અને ચક્કો | (૨૩) નાડિઓ અને ત્રિબંધ | (૨૪) યોગના પ્રકાર |
| (૨૫) સૂર્યનમસ્કાર | (૨૬) રાજ્યોગ | (૨૭) યૌગિક ચિકિત્સાના અંગો |
| (૨૮) પાતંજલ યોગસૂત્ર | (૨૮) હઠયોગપ્રદિપિકા | (૩૦) આહાર વિજ્ઞાન અને યોગ |
| (૩૧) માનસિક સ્વાસ્થ્ય અને યોગ | (૩૨) નિસર્ગોપચાર | (૩૩) ઇયાબિટીસ અને યોગ |
| (૩૪) હસ્તમુદ્રાઓ અને ત્રિબંધ | (૩૫) હદ્યરોગ અને યોગ | (૩૬) બી.પી. અને યોગ |
| (૩૭) કબજીયાત અને યોગ | (૩૮) ક્ષય અને યોગ | (૩૮) સાયકોથેરાપી અને યોગ |
| (૪૦) ભગવત ગીતા | (૪૧) મંદાળિન અને યોગ | (૪૨) વિવિધ ધર્મોમાં યોગ |
| (૪૩) ધર્દદર્શનનો પરિચય | | |

AM

પેપર-૧૦ પ્રાયોગિક

(૧) પ્રાર્થના અને મંત્રોનું ગાન

➤ ગુજરાતી અને સંસ્કૃતમાં

(૨) યૌંગિક કિયાઓ

➤ શ્વાસ અને પ્રશ્વાસના કમ સાથે

- | | | |
|------------------------|---------------------------|---------------------------|
| (૧) મસ્તિકની કિયા | (૨) આંખની કિયા | (૩) કાનની કિયા |
| (૪) મુખ અને સ્વરનીકિયા | (૫) ગર્દનની કિયા | (૬) ખભાની કિયા |
| (૭) હાથની કિયા | (૮) છાતી અને કેફસાની કિયા | (૯) પેટની કિયા |
| (૧૦) કમરની કિયા | (૧૧) પગની કિયા | (૧૨) ગોઠળ અને પંજાની કિયા |
| (૧૩) કાયોત્સર્વ | | |

(૩) પ્રાણાયામ

- (૧) ઓમકાર પ્રાણાયામ
(૪) શિતલી
(૭) ચંદ્રભેદન

- (૨) બામરી
(૫) શિતકારી
(૮) ઉજ્જ્વલી

- (૩) ભસ્ત્રકા
(૬) સૂર્યભેદન
(૯) અનુલોમ વિલોમ

(૪) બંધના પ્રકાર :-

- ઉદ્દિયાન બંધ - મુલબંધ
➤ જાલબંધ બંધ
➤ મહાબંધ / ત્રિબંધ

(૫) સૂર્યનમસ્કાર

- સૂર્યનમસ્કાર શ્વાસપ્રશ્વાસ, કાઉન્ટ સાથે
➤ સૂર્યનમસ્કાર મંત્રો સાથે

(૬) ઘરૂકર્મ :-

- (૧) નેતિ
➤ કેથેટરનેતિ, સૂત્રનેતિ, જલનેતિ, કુંજર/ ગંગકરણી
(૨) ધૌતિ
➤ વસ્ત્રધૌતિ
➤ સ્ટમકટયુબ
(૩) કપાલભાતિ
(૪) ગ્રાટક
➤ આંતરગ્રાટક અને બાબુ ગ્રાટક



Dr. S. L. Patel

Department of Sanskrit & English, Gurukul Kangri University of Sanskrit,
Haridwar, Uttarakhand, India
Mobile No.: +91 9810000000

(५) નૌલિ

- વામનૌલિ
- દક્ષિણનૌલિ
- મધ્યનૌલિ

(૬) શિથિલિકરણ વ્યાયામ

- બેઠા બેઠા
- સૂતા સૂતા
- ઉભા ઉભા
-

(૭) મુદ્રાઓનો પરિચય :-

હસ્તમુદ્રા :-

- (૧) જ્ઞાનમુદ્રા
(૫) વાયુમુદ્રા

- (૨) શુન્યમુદ્રા
(૬) સુર્યમુદ્રા

- (૩) પૃથ્વીમુદ્રા

- (૪) આકાશમુદ્રા

ધરેડમુદ્રા :-

- (૧) શાંખવીમુદ્રા
(૫) કાકીમુદ્રા

- (૨) અગોચરી મુદ્રા

- (૩) પાશાનીમુદ્રા

- (૪) યોગમુદ્રા

(૮) આસન પરિચય :-

(૧) ત્રિકોણાસન	(૨) હંસાસન	(૩) અર્ધચંદ્રાસન	(૪) ગરૂડાસન
(૫) પસ્થિમોતાનાસન	(૬) કર્ણપીડાસન	(૭) અર્ધમટ્યેન્દ્રાસન	(૮) મયૂરાસન
(૮) સ્વસ્તિકાસન	(૧૦) તુલાસન	(૧૨) સેતુબંધાસન	(૧૩) સિંહાસન
(૧૪) મકરાસન	(૧૫) આકર્ષણુરાસન	(૧૬) જ્ઞાનાસન	(૧૭) બકાસન
(૧૮) ગંધિકાસન	(૧૮) શલભાસન	(૨૦) પાશ્વકોણાસન	(૨૧) સર્વાગાસન
(૨૨) મત્સ્યાસન	(૨૩) ઉત્તાનપાદાસન	(૨૪) પવનમુક્તાસન	(૨૫) નૌકાસન
(૨૬) યોગેન્દ્રાસન	(૨૭) પદ્મમધૂરાસન	(૨૮) સુપ્તવજ્ઞાસન	(૨૬) બધ્યપદ્માસન
(૩૦) શ્વેતગુરુતાસન	(૩૧) કુર્માસન	(૩૨) વૃષ્ટોતાનાસન	(૩૩) કુકલાસન
(૩૪) શ્રુંગાલાસન	(૩૫) માર્જરાસન	(૩૬) સર્પાસન	(૩૭) વાતાવાનાસન
(૩૮) પદ્મશિર્ધાસન	(૩૮) અષ્ટવકાસન	(૪૦) ઉત્થિતપદ્માસન	(૪૧) અર્થપદમાશન
(૪૨) સોપાનાસન	(૪૩) દ્વિપાદશિરાસન	(૪૪) પ્રાર્થનાસન	(૪૫) સંકટઆસન
(૪૬) યોગદાસન	(૪૭) વ્યાધાસન	(૪૮) ઉત્થીત પાદહસ્તાસન	
(૪૯) કાકાસન	(૫૦) સ્વાનાસન		

(૯) એજ્યુકેશન ટુર (યોગ, આર્યવેદિક, નિસંગોપચારની સંસ્થાઓની એજ્યુકેશન ટુરનો રિપોર્ટ લેવો)

મ